


તાત્કાલિક માતૃત્વ ચેતવાણી ચિહ્નો



માથાનો દુખાવો જે દૂર થતો નથી અથવા સમય જતાં વધુ વણસે



ચક્કર અથવા બેહોશી



એવા વિચારો જે પોતાને અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડે




તમારી જોવાની શક્તિમાં ફેરફાર



તાવ



શ્વાસ લેવામાં તકલીફ



છાતીમાં દુખાવો અથવા ઝડપી ધબકારા



પેટનો તીવ્ર દુખાવો જે દૂર થતો નથી




ગંભીર ઉબકા અને ઓકી કાઢવું (મોર્નિંગ સિકનેસ જેવું નહીં)



બાળકની હલનચલન બંધ થવી અથવા ધીમી થવી



સગર્ભાવસ્થા દરમિયાન યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ અથવા પ્રવાહી નીકળવું



સગર્ભાવસ્થા પછી યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ અથવા પ્રવાહી નીકળવું



તમારા પગમાં સોજા, લાલાશ અથવા દુખાવો



તમારા હાથ અથવા ચહેરા પર અતિશય સોજા



પ્રતિકાર થઈ શકે નહિ તેવું થાક

જો તમને સગર્ભાવસ્થા દરમિયાન અથવા પછી આમાંના કોઈપણ લક્ષણો હોય, તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક કરો અને તરત જ મદદ મેળવો.

જો તમે તમારા પ્રદાતા સુધી ના પહોંચી શકો, તો ઈમરજન્સી રૂમમાં જાઓ. આ કહેવાનો યાદ રાખો કે તમે ગર્ભવતી છો અથવા છેલ્લા વર્ષમાં ગર્ભવતી છો.

વધુ જાણો: <https://saferbirth.org/aim-resources/aim-cornerstones/urgent-maternal-warning-signs/>



વધુ જાણવા માટે ફોટો લો

© 2022 American College of Obstetricians and Gynecologists. આ દસ્તાવેજની નકલ અને વિતરણ માટે, તેની સંપૂર્ણતામાં અને ફેરફાર કર્યા વિના, ફક્ત શૈક્ષણિક, ગુણવત્તા સુધારણા અને દર્દીની સલામતીના હેતુઓ માટે હોય તેવી બિન-વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવે છે. અન્ય તમામ ઉપયોગોને ACOG તરફથી લેખિત પરવાનગી જરૂરી છે.